

-: અખબારી યાદી:-

## “વન વીક, વન રોડ” ઝુંબેશ

સેન્ટ્રલ ઝોનમાં બજરંગ વાડી મેઈન રોડ ખાતે વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ:

તારીખ: ૨૦-૦૧-૨૦૨૨

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા. ૨૦-૦૧-૨૦૨૨ના રોજ સેન્ટ્રલ ઝોનમાં બજરંગ વાડી મેઈન રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે.

### (ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૨ માં સમાવિષ્ટ બજરંગવાડી મેઈન રોડ પર ફૂટપાથક માજિન તથા રોડમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૧૫ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૪૧૪૪ ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે

જેમાં (૧) શક્તિ પાન, (૨) સહજ કોમ્પ્લેક્સ, (૩) ખોડીયાર ફ્લોર મિલ, (૪) સોમનાથ ભેળ હાઉસ, (૫) ખોડીયાર કટપીસ, (૬) અસરફ બાઈન્ડીંગ, (૭) ભગવતી શોપિંગ, (૮) આવકાર પ્રોવિઝન સ્ટોર, (૯) જય વાસણ ભંડાર, (૧૦) રિદ્ધી સિદ્ધી જનરલ સ્ટોર, (૧૧) મહેરાજ ફરસાણ, (૧૨) બાલાજી ખમણ, (૧૩) ખોડીયાર કોમ્પ્લેક્સ, (૧૪) અમૃત ડેરી ફાર્મ અને (૧૫) મહાદેવ ફેશન ખાતેથી ફૂટપાથ પર ઓટલાનું દબાણ તેમજ પાર્કિંગમાં નડતરરૂપ દબાણ દુર કરવામાં આવેલ છે.

### (ફૂડ શાખાની કામગીરી)

- વન વીક વન રોડ અંતર્ગત FSSAI-2006 અન્વયે મિક્સ દૂધના લેવાયેલ ૨ નમુના
- વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના જામનગર રોડ થી બજરંગવાડી મેઈન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૯ ફૂડ

બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૧૧ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

• નમુનાની કામગીરી -

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ મિક્સ દૂધના ૨ નમૂના લેવામાં આવેલ :-

(૧)મિક્સ દૂધ (લુઝ) સ્થળ- શ્રીગાયત્રી ડેરી ફાર્મ - બજરંગવાડી મેઇન રોડ

(૨) મિક્સ દૂધ (લુઝ) સ્થળ- અમૃત ડેરી ફાર્મ - બજરંગવાડી મેઇન રોડ

ખાણી-પીણી ના ધંધાર્થિઓની ચકાસણીની વિગત :-

ફૂડ વિભાગ દ્વારા તા. ૨૦/૦૧/૨૦૨૨ ના રોજ શહેરના જામનગર રોડ થી બજરંગવાડી મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧)વિજય જનરલ સ્ટોર- લાયસન્સ બાબતે નોટીસ (૨)શિવ શક્તિ બેકરી - લાયસન્સ બાબતે નોટીસ (૩)શ્રી ખોડિયાર ફ્લોર મીલ - લાયસન્સ બાબતે નોટીસ (૪)પુજા પાન એન્ડ કોલર્ડ્રિક્સ - લાયસન્સ બાબતે નોટીસ (૫)જય બજરંગ પ્રોવિઝન સ્ટોર - લાયસન્સ બાબતે નોટીસ (૬) બજરંગ મેડિકલ સ્ટોર - લાયસન્સ બાબતે નોટીસ (૭) જડેશ્વર સેલ્સ એજન્સી (૮) આવકાર પ્રોવિઝન સ્ટોર - લાયસન્સ બાબતે નોટીસ (૯) મીરા પાન & કોલર્ડ્રિક્સ - લાયસન્સ બાબતે નોટીસ (૧૦) સાઈ પાન & કોલર્ડ્રિક્સ - લાયસન્સ બાબતે નોટીસ (૧૧) વાડોલીયા એજન્સી - લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

તથા (૧૨)શક્તિ પાન & આઇસક્રીમ પાર્લર (૧૩)શ્રી ગાયત્રી ડેરી ફાર્મ (૧૪) માનવ મેડીસીન્સ (૧૫)રાધે ફરસાણ & સ્વીટ (૧૬) જય બજરંગ જનરલ સ્ટોર (૧૭)મંગલ પાર્લર (૧૮)ઉમિયાજી સેલ્સ એજન્સી (૧૯) અમૃત ડેરી ફાર્મ. ની ચકાસણી કરેલ.

**(સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી)**

વન વીક વન રોડ અંતર્ગત બજરંગ વાડી મેઇન રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ ૦૪ આસામીઓ પાસેથી રૂ. ૧,૦૦૦/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૦૬ આસામીઓ પાસેથી રૂ. ૩.૨૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ, કુલ ૧૦ આસામીઓ પાસેથી રૂ. ૪,૨૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

**(દબાણ હટાવ શાખાની કામગીરી)**

વન વીક વન રોડ અંતર્ગત બજરંગ વાડી મેઇન રોડ દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત કરેલ રેકડી/કેબીનની સંખ્યા - ૦૧, જપ્ત કરેલ પરચુરણ માલસામાન - ૦૫ અને જપ્ત કરેલ બોર્ડ-બેનર - ૧૭૦ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

**(બાંધકામ/વોટરવર્ક્સ/ડ્રેનેજ શાખાની કામગીરી)**

બાંધકામ/વોટરવર્ક્સ/ડ્રેનેજ શાખા સેન્ટ્રલ ઝોન બજરંગવાડી મેઇન રોડ વોર્ડ નં.૨ દ્વારા વન વીક , વન રોડ અંતર્ગત આજે તા.૨૦/૦૧/૨૦૨૨ના રોજ સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઇ સંખ્યા - ૧૦, ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્યા- ૨૦, પાણીની વાલ્વ ચેમ્બર સફાઇ સંખ્યા - ૧૫, ફૂટપાથ રીપેરીંગ (ચો.મી.) ૫, પેવીંગ બ્લોક રીપેરીંગ-(ચો.મી.) - ૩૦, રોડ રીપેરીંગ (ચો.મી.) - ૦, રબ્બીશ ઉપાડવાનું કામ.(ધ.મી.) - ૧૮. વિગેરે કામગીરી કરવામાં આવી હતી. હાલ કામગીરી ચાલી રહી છે.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા